

સિદ્ધ | IITના અધ્યાપકને યંગ ફેકલ્ટી રિસર્ચ ફેલોશિપ

અમદાવાદ | આઈઆઈટી ગાંધીનગરના અધ્યાપક ડો.નિહાર રંજન મોહપાત્રને કોમ્પ્યુનિકેશન્સ એન્ડ આઈટી મંત્રાલય દ્વારા યંગ ફેકલ્ટી રિસર્ચ ફેલોશિપ એનાયત કરાઈ છે. ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરિંગ આઈટીના ક્ષેત્રમાં રિસર્ચ કરતા યુવાન અધ્યાપકોને પ્રોત્સાહન આપવા માટે આ ફેલોશિપ એનાયત કરવામાં આવે છે. પાંચ વર્ષમાં 200 યુવાન અધ્યાપકોને યંગ ફેકલ્ટી રિસર્ચ ફેલોશિપ એનાયત કરવામાં આવશે. પ્રો. મોહપાત્રએ જણાવ્યું હતું કે મને આ એવોર્ડ મળતા ઘણો આનંદ થયો છે અને તેનાથી મારા સંશોધનમાં મને સહાય મળશે. પ્રો.મોહપાત્ર હાલમાં હાઈવોલ્ટેજ એપ્લિકેશન્સ માટે નેનોડીવાઈસીસ ડેવલપ કરી રહ્યા છે.